

ذوکصولو جیا طولتے - مجاز کار

الباحث الثاني

περιττούς είναι τα πάντα τα οποία δεν μπορούν να γίνουν στην αριθμητική συσκευή.

ει πη νη τετραθωποις ευδο και αγι

لَكْ دُجْ شَتْ كُوكْ رِي بَا مُونْ حُوكْ بِسْتَنْ

غَلِّيْجَ مِنْ تَرْكَ شَشَ لَذْكَ جَمِيعَ نَ

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ
رَبِّ الْعَالَمِينَ حَمَدُ اللَّهِ أَكْبَرُ
لَا إِلَهَ إِلَّا هُوَ يَعْلَمُ بِمَا
يَعْمَلُ وَلَا يُنَزَّلُ لِكُلِّ خَلْقٍ مِّنْهُ

Κυρί Σε πανταχού είμαι πάντα σε σας

πατέραντο χρα τοπί Κυρίες τι ε μο νο

א יכ או. תרו יא

84 οὐτοὶ δέ τις πάντες οὐδὲν εἰσίν τοι
οὐδὲν τοι εἰσίν πάντες δέ τις οὐδὲν

ω $\alpha \omega$ $\nu \alpha \tau \theta$ $\alpha \omega$ $\nu \alpha \sigma$

فَيَا ظَلَّافَ نُخْ أَنْ لَّا يَرَى كَمْ يَكُونُ أَكَبَّ نَالَ لَهُ

لهم إني أنت لست بغيرك فما في اليوم ذا ذم

$$E_{\text{cav}} \propto \gamma_3 \cos \theta_1 \quad \text{and} \quad p_c \approx 0 \quad \theta_3 \approx 90^\circ \quad \text{and}$$

— Εγενέτης — Καίρος — Τετρακόσιος —
Πάτερ ρωμαίων καὶ αἰνετού παιδεῖ δοξα σριε

وَمَعْلُوسٌ سِيَّارٌ مُّهَاجِرٌ مُّهَاجِرٌ مُّهَاجِرٌ

வாசமுறை

۱۰۷- لِلَّهِ الْحَمْدُ لِمَنْ يَرَى
لِلَّهِ عَزَّ ذِيْلَهُ لِمَنْ يَشَاءُ

Eu ἀριθμοὶ εἰ μὲν πεντακοσία

نے ملے غلن بہ رب یا شان کو ر جام
نکنے کے لئے اپنے دل کے ساتھ
و ب جی نی ناز ش کنن آ ج ملہ بہ رب یا
نف ف واسنی حم پڑت رب یا ش قل نا دھنہ تھے جبل
تیک ہٹ طیخ قزت نی ن آن ب ت سی
کو پر ا پرسنگاڑے ڈی ڈی
اویس ۱۸۰۱۱۷۰ ۰۴ ۲۶ ۰۵۰۰
یا شان بیک بیک بیک بیک بیک بیک بیک
الغور ن ی عان کو ر نو بیک بیک

جَبَرِيلُ مُصَدِّقٌ لِكُلِّ شَيْءٍ — كُلُّ شَيْءٍ مُصَدِّقٌ لِجَبَرِيلِ
Ta pa acti vor zo ε . ٨٤ ٥ ٥٦ ٨٤
سَدِّيْكَ مُصَدِّقٌ لِكُلِّ شَيْءٍ لِكُلِّ شَيْءٍ مُصَدِّقٌ لِسَدِّيْكَ
tais yu vw oxos os os A γι ος ο θεος αγιος
بَايَكَ مُصَدِّقٌ لِكُلِّ شَيْءٍ لِكُلِّ شَيْءٍ مُصَدِّقٌ لِبَايَكَ
I oxypos* Ayios a tha va zos ε . ٨٤ ٥ ٥٧ mas
سَدِّيْكَ مُصَدِّقٌ لِكُلِّ شَيْءٍ لِكُلِّ شَيْءٍ مُصَدِّقٌ لِسَدِّيْكَ
سُدُّوْ قَذْ هُمْ دِي الَّقَ (نِ) سُدُّوْ قَذْ هُمْ دِي اللَّهَ (نِ) سُدُّوْ قَذْ
نَانِيْكَ مُصَدِّقٌ لِكُلِّ شَيْءٍ لِكُلِّ شَيْءٍ مُصَدِّقٌ لِنَانِيْكَ
نَانِيْكَ مُصَدِّقٌ لِكُلِّ شَيْءٍ لِكُلِّ شَيْءٍ مُصَدِّقٌ لِنَانِيْكَ
دَسْنِ الَّقِيْحَ رَوَالَزِنِ الَّبِيْ وَ بِرِ آ بِلِهِ دُمْجَهُ أَلِهِ
سَدِّيْكَ مُصَدِّقٌ لِكُلِّ شَيْءٍ لِكُلِّ شَيْءٍ مُصَدِّقٌ لِسَدِّيْكَ
Kai vuv kai a εικαιειστεσ αω ναστωνω υων
—
ا μην
يَسِّيْلَهَ مُصَدِّقٌ لِكُلِّ شَيْءٍ لِكُلِّ شَيْءٍ مُصَدِّقٌ لِسَيِّلَهَ
يَلِنِيْكَ مُصَدِّقٌ لِكُلِّ شَيْءٍ لِكُلِّ شَيْءٍ مُصَدِّقٌ لِلَّيِّنِيْكَ
جَبَرِيلُ مُصَدِّقٌ لِكُلِّ شَيْءٍ لِكُلِّ شَيْءٍ مُصَدِّقٌ لِجَبَرِيلِ
A α αγιος Ayios ٥
بَيِّنَهَ مُصَدِّقٌ لِكُلِّ شَيْءٍ لِكُلِّ شَيْءٍ مُصَدِّقٌ لِبَيِّنَهَ

ن س دو فڑ دو
 قریب ایسا کسی کسی
 دی ایش
 A A y_c os
 A θa A θa va cos ε
 A ε γ θa γ ma as